

### ANUPAM RASAYAN INDIA LTD.

Date: February 12, 2022

ARILSLDSTX20220212076

To,

BSE Limited,

Phiroze Jeejeebhoy Towers,

Dalal Street,

Mumbai -400001, India

SCRIP CODE: 543275

To,

Sr. General Manager

National Stock Exchange of India Limited

'Exchange Plaza', C-1, Block-G,

Bandra Kurla Complex

Bandra (East), Mumbai 400051, India

**SYMBOL: ANURAS** 

Dear Sir/Madam,

<u>Subject</u>: <u>Newspaper advertisement pertaining to unaudited financial results (standalone and consolidated) for the quarter and nine months ended December 31, 2021</u>

Pursuant to Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended, the newspaper advertisement published pertaining to unaudited financial results (standalone and consolidated) of the Company for the quarter and nine months ended December 31, 2021 in Financial Express (English) and Dhabkar (Gujarati) on February 12, 2022 are enclosed herewith.

This information will also be hosted on the Company's website at <a href="https://www.anupamrasayan.com">www.anupamrasayan.com</a>

We request you to kindly note the same and take into your records.

Thanking you,

Yours Faithfully,

For, Anupam Rasayan India Limited

Suchi Agarwal

Company Secretary & Compliance Officer

M.N.: A32822

AUTHORIZED A

Tel.

Fax

: +91-261-2398991-95

E-mail: office@anupamrasayan.com

: +91-261-2398996

Website: www.anupamrasayan.com CIN - L24231GJ2003PLC042988

# **FINANCIAL EXPRESS**

PUBLIC NOTICE M/s. Mudra Finance Limited ('the Company') having its Registered Office at G-12/A, First Floor, Hauz Khas New Delhi-110016 and Corporate Office at Vipul TechSquare, Golf Course Road, Sector-43, Gurugram-122009, Harvana, had made provisional allotment of Residential/Commercial Flats in the project namely Vipul

Gardens, Dharuhera, Haryana, against the Earnest Money cum booking amount, and upon signing of Company's application forms containing terms and conditions of the allotment. As per the records maintained by the Company, the following Allottees have not paid their respective dues/installments/interest etc. as per the terms of the provisional allotment(s), despite several reminders in

S. No.	Applicant Name	Tower	Unit	Address	Area (sq. ft.)
1	MR. ASHWANI KUMAR SHARMA MR. JAWAHAR LAL BAKSHI	4	1102	Kothi No - 117, Sector-12 A, Panchkula, Haryana	1240
2	MR. GULSHAN LUTHRA	2	1001	1046, Sector- 14, Gurgaon-122001	1512
3	MR. GULSHAN LUTHRA	3	602	1046, Sector- 14, Gurgaon-122001	1273
4	MR. VERESH KALRA MRS. RENU KALRA	2	801	C-88, Road No-40, West Punjabi Bagh, New Delhi	1512
5	MRS. RENU KALRA MR. VERESH KALRA	5	303	C-88, Road No-40, West Punjabi Bagh, New Delhi.	1240
6	MR. INDU RAJ	4	104	204, Sukhdev Vihar, New Delhi-110025	1371
	e : February 11, 2022 se : Gurugram		-	For and on behalf of Mudra Finance	Limited Sd/- Director

() le	FORM G - INVITATION FOR EX der Regulation 36A (1) of the Insolvency and Bankruptcy (Insolvency	
(VIII	RELEVANT PAI	
1	Name of corporate debtor	Blue Blends (India) Limited
2	Date of incorporation of corporate debtor	16" February 1981
3	Authority under which corporate debtor is incorporated/registered	Registrar of Companies, Mumbai, Maharashtra
4	Corporate identity number / limited liability identification number of corporate debtor	L17120MH1981PLC023900
5	Address of the registered office and principal office (if any) of corporate debtor	Registered Office Address: JBF House, 2nd Floor, Old Post Office Lane, Kalbadevi Road Mumbai – 400022, Maharashtra; Other Places of Business: 1. Manufacturin; Unit: Saijpur Gopalpur Piplaj 123/2 Ahmedabat – 382405, Gujarat; and 2. Office premises: 603 Sahajanand, Shahibaug Road, Ahmedabad – 380004
6	Insolvency commencement date of the Corporate Debtor	2" December 2021
7	Date of invitation of expression of interest	12" February 2022
8	Eligibility for resolution applicants under section 25(2)(h) of the Code is available at:	Details can be sought by emailing to ip.blueblends@sankalp-ipe.com
9	Norms of ineligibility applicable under section 29A are available at:	Details can be sought by emailing to ip.blueblends@sankalp-ipe.com
10	Last date for receipt of expression of interest	27" February 2022
	Date of issue of provisional list of prospective resolution applicants	9" March 2022
12	Last date for submission of objections to provisional list	14" March 2022
13	Date of issue of final list of prospective resolution applicants	24" March 2022
14	Date of issue of information memorandum, evaluation matrix and request for resolution plans to prospective resolution applicants	14° March 2022
15	Manner of obtaining request for resolution plan, evaluation matrix, information memorandum and further information	By Electronic Means from ip.blueblends@sankalp-ipe.com
16	Last date for submission of resolution plans	13" April 2022
	Manner of submitting resolution plans to resolution professional	By Registered Post or hand delivery in sealed envelope to the address mentioned at point 2' and by sending an email to ip.blueblends@sankalp-ipe.com
18	Estimated date for submission of resolution plan to the Adjudicating Authority for approval	13" May 2022
19	Name and registration number of the resolution professional	Mr. Vinit Gangwal IBBI/IPA-002/IP-N00091/2017-2018/10235
20	Name, Address and e-email of the resolution professional, as registered with the Board	Address: Office No.503, Varun capital, CTS No.364+365/13, Off. J.M. Road, Bharat Petroleum Lane, Next to Citiotel, Shivajinagar, Pune, Meharashtra, 411005

Place: Mumbai Vinit Gangwal Date: 12.02.2022 Resolution Professional Blue Blends (India) Limited Address: Office No.503, Varun capital, CTS No.364+365/13, Off. J.M. Road, Bharat Petroleum Lane Next to Citotel, Shivalinagar, Pune, Maharashtra - 411005

Address and email to be used for correspondence

with the resolution professional

22 Further Details are available at or with

23 Date of publication of Form G

Pune, Maharashtra - 411005

Email: ip.vinitgangwal@sudharman.in

Email-ip.blueblends@sankalp-ipe.com

ip.blueblends@sankalp-ipe.com

12" February 2022

Address - 4th Floor, 401, The Central, Shell

Colony Road, Chembur (East), Mumbai-



# ANUPAM RASAYAN INDIA LTD.

Corporate Identification Number (CIN): L24231GJ2003PLC042988 Registered Office: 8110, GIDC Industrial Estate, Sachin, Surat - 394230, Gujarat, India. Tel. No.: +91-261-2398991-95; Fax: +91-261-2398996 Email: office@anupamrasayan.com, Website: www.anupamrasayan.com

## POSTAL BALLOT NOTICE AND E-VOTING INFORMATION

Members of Anupam Rasayan India Limited (the "Company") are requested to note that pursuant to and in compliance of section 108 and section 110 of Companies Act, 2013 and all other applicable provisions of the Companies Act, 2013 ("the Act") read with rule 20 and rule 22 of Companies (Management & Administration) Rules, 2014 ("the rules") (including any statutory modifications or re-enactment(s) thereof for the time being in force) read with the General Circular No. 14/2020 dated April 8, 2020, the General Circular No. 17/2020 dated April 13, 2020, the General Circular No. 22/2020 dated June 15, 2020, the General Circular No. 33/2020 dated September 28, 2020 and the General Circular No. 39/2020 dated December 31, 2020 and other relevant circulars and notifications issued by the Ministry of Corporate Affairs (hereinafter collectively referred to as "the MCA Circulars"), the Company has completed the dispatch of Postal Ballot Notice along with the notes and the explanatory statement on February 11, 2022 electronically to all those Members whose names appear on the Register of Members / List of Beneficial Owners as on February 10, 2022 ("Cut-off date") received from the Depositories and whose e-mail address are registered and available with the Company / Depositories, seeking approval of the Members in respect of the special resolution proposed under regulation 17(1A) of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements), Regulations, 2015, for continuation of directorship of Mr. Vijay Kumar Batra (DIN: 00038275) on the board of directors of the company, who shall attain the age of 75 years on March 13, 2022, by way of postal ballot through remote e-voting process only.

The Postal Ballot Notice ("Notice") is available on the website of the Company at www.anupamrasayan.com, the websites of the stock exchanges i.e. BSE Limited ('BSE') and National Stock Exchange of India Limited ('NSE') at www.bseindia.com and www.nseindia.com respectively and the website of the National Securities Depository Limited (NSDL) https://www.evoting.nsdl.com.

## Information on e-voting:

In terms of the MCA Circulars read with the applicable provisions under the Act and rules made thereunder, Members can cast their votes through remote e-voting only. The Company has engaged NSDL for providing remote e-voting facility for this Postal Ballot. The Members whose name appear on the Register of Members / list of beneficial owners as on the Cut-off date only would be considered for the purpose of e-voting. A person who is not a Member as on the Cut-off date should treat this postal ballot notice for information purposes only. Voting rights of a member / beneficial owner shall be in proportion of his/her/its shareholding in paid-up equity capital of the Company as on the cut-off date. Once the vote on a resolution is cast by the member, he shall not be allowed to change it subsequently or cast the vote again. Members may cast their votes during the period mentioned hereinbelow:

### Commencement of e-voting: 09:00 am (IST) on Saturday, February 12, 2022 Conclusion of e-voting: 05:00 pm(IST) on Sunday, March 13, 2022

E-voting shall be disabled and shall not be allowed beyond 05:00 pm (IST) on Sunday, March 13, 2022. Postal ballot received / votes cast from the member beyond the said date will not be valid and voting by electronic means shall not be allowed beyond the said date. The results of e-voting shall be made available not later than Tuesday, March 15, 2022. The resolution as stated in the Notice, if approved by the Members with requisite majority shall be deemed to have been passed on Sunday, March 13, 2022. The results of the voting by means of postal ballot shall be made available at the website of the Company at www.anupamrasayan.com and on the website of NSDL at https://www.evoting.nsdl.com. The results shall be also communicated to the BSE and NSE, and the same shall be available on their respective websites.

Detailed instructions and notes pertaining to process and manner of e-voting for the Members of the Company are provided in the Postal Ballot Notice. The process and manner of e-voting is also available on the website of the Company at www.anupamrasayan.com for reference purpose for the Members.

# Manner of registering/updating e-mail address:

Members are requested to note and follow the below steps for registering/updating their e-mail address for receiving the Postal Ballot Notice and remote e-voting.

- Members holding shares in dematerialised form as on cut-off date i.e. February 10, 2022 who are eligible to receive the postal ballot notice and cast their vote, and have not received the postal ballot notice are requested to contact their Depository Participants ('DP's) for registering their e-mail address and follow the process stipulated by DP's for registering e-mail address. Consequent to the registration/updation of e-mail address after the Cut-off date with their DP's, Members are requested to communicate the same to the Company/RTA/NSDL by writing an e-mail to investors@anupamrasayan.com, einward.ris@kfintech.com and evoting@nsdl.co.in.
- 2. In case of any queries/grievances, Members may refer the Frequently Asked Questions (FAQs) for Members and e-voting user manual for Members available at the download section of www.evoting.nsdl.com. Members, who need assistance for e-voting can contact NSDL official Ms Sarita Mote on toll free no.: 1800-1020-990 and 1800-22-44-30 or send a request at evoting@nsdl.co.in.

For Anupam Rasayan India Limited Suchi Agarwal METRO COMMERCIAL COMPANY LIMITED

Read, Office: B. R. Chandak Market, Manwari Patty, Ward No 6, Guwahati, Jorhat, AS-785001 IN Email: metrocommercialcompany@gmail.com, Website: www.metrocommercialcompany.com, CIN: L51109AS1985PLC002401 Extract of Statement of Standalone and Consolidated Unaudited Financial Results for the Quarter and nine months ended December 31, 2021

			Standalone		Conso	lidated	
S. No	Particulars	Particulars 31.	Quarter ended 31.12.2021 (Unaudited)	Nine Months ended 31.12.2021 (Unaudited)	Quarter ended 31.12.2020 (unaudited)	Quarter ended 31.12.2021 (Unaudited)	Nine Months ended 31.12.2021 (Unaudited)
1	Total Income from Operation (net)	2.16	8.71	1.73	2.16	8.71	
2	Net Profit/ (Loss) for the quarter/year (before Tax, Exceptional and/or Extraordinary Items) Net Profit/(Loss) for the quarter/year before tax (after	(0.38)	1.21	(1.17)	(0.38)	1.21	
9	Exceptional and/or Extraordinary Items)	(0.38)	1.21	(1.17)	(0.38)	1.21	
4	Share of Profit from Associate & Joint Venture		-		(0.10)	0.06	
6	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)  Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive	(0.38)	1.21	(1.17)	(0.48)	1.27	
	Income (after tax))	(0.38)	1.21	(1.17)	(0.48)	1.27	
7	Equity Share Capital	100.00	100.00	100.00	100.00	100.00	
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	27		2	9.7		
9	Earnings Per Share (of ₹ 10/- each) (for continuing and discontinued operations) -		nessers.	20000000	on seems	24000	
	Basic:	(0.04)	0.12	(0.12)	(0.05)	0.13	
	Diluted:	(0.04)	0.12	(0.12)	(0.05)	0.13	

(Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity www.metrocommercialcompany.com.

b) Ind AS compliant Financial results for the guarter and nine months ended December 31, 2021 were reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at their respective meetings held on 11/02/2022. For and on behalf of the Board of Directors

For METRO COMMERCIAL COMPANY LIMITED Vishal Kumar Sharma Date: 11.02.2022 Wholetime Director DIN: 07310503 Place: Guwahati



PLACE: AGRA

# PEE CEE COSMA SOPE LTD.

CIN: L24241UP1986PLC008344. Regd. Office: Padamplaza, Hall No. H1-H2, First Floor, Plot No.5, Sector-16B Awas Vikas Sikandra Yojna, Agra - 07 (U.P.), Tel.: 0562-2527330/31/32 , Fax: 0562-2527329 E-mail: pccosmalisting@doctorsoap.com Website: www.doctorsoap.com

#### EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31ST DEC 2021 ₹ in Lacs PARTICULARS Nine Month Ended Year Ended Quarter Ended 31.12.2021 30.09.2021 31.12.2020 31.12.2021 31.12.2020 31.03.2021 UNAUDITED UNAUDITED UNAUDITED UNAUDITED AUDITED 6777.00 6350.29 8283.87 Total Income from Operations 2282.18 2198.78 2004.10 Net Profit for the period (before Tax, 644.18 12.81 92.45 166.33 209.91 563.15 Exceptional and/or Extraordinary items) Net Profit for the period before Tax 12.81 166.33 209.91 563.15 644.18 92.45 (after Exceptional and/or Extraordinary items) Net Profit for the period after Tax 125.41 157.48 416.98 476.63 10.24 69.03 (after Exceptional and/or Extraordinary items) Total Comprehensive Income for the period 10.24 157.48 416.98 476.63 69.03 125.41 [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] Paid-up Equity Share Capital 264.63 264.63 264.63 264.63 264.63 264.63 (face value of Rs.10/-each) Earning per share (Quarterly not annualised) Basic (Rs.) Diluted (Rs.) 0.40 18.00 2.60 4.70 6.00 15.80

Notes: (1) The above is an extract of the detailed format of Financial Results for Quarter and Nine months ended December 31, 2021 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Results are available on the websites of Stock Exchange (www.bseindia.com) and the Company's website (www.doctorsoap.com). (2) The above Results were Reviewed and recommended by the Audit Committee & approved by the Board of Directors at their Meeting held on Feburury 11, 2022. (3) An Independent Auditors Review Report as required under Regulation 33 of the SEBI ( Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 has been completed on detailed Unaudited Financial Results for the quarter and nine months ended December 31, 2021 filed with the Stock Exchanges, (4) Figures for the previous period have been regrouped wherever necessary, to conform to the current period's For & on behalf of the Board

> PEE CEE COSMA SOPE LIMITED MAYANK JAIN (Executive Chairman)





DIN: 00112947

## I HDFC MUTUAL FUND BHAROSA APNO KA

**HDFC Asset Management Company Limited** A Joint Venture with abrdn Investment Management Limited CIN: L65991MH1999PLC123027

Registered Office: HDFC House, 2nd Floor, H.T. Parekh Marg, 165-166, Backbay Reclamation, Churchgate, Mumbai - 400 020, Phone: 022 66316333 • Toll Free Nos: 1800-3010-6767 / 1800-419-7676 Fax: 022 22821144 • e-mail: hello@hdfcfund.com • Visit us at: www.hdfcfund.com

# NOTICE

NOTICE is hereby given that HDFC Trustee Company Limited, Trustee to HDFC Mutual Fund ("the Fund"), has approved the following Distribution under Income Distribution cum Capital Withdrawal ("IDCW") in the following Scheme(s) / Plan(s) of the Fund and fixed February 17, 2022 (or the mmediately following Rusiness Day, if that day is not a Rusiness Day) as the Record Date for the same

Name of the Scheme(s) / Plan(s) / Option(s)	Net Asset Value ("NAV") as on February 10, 2022 (₹ per unit)	Amount of Distribution* (₹ per unit)	Face Value (₹ per unit)	
HDFC Focused 30 Fund - Regular Plan - IDCW Option (Payout and Reinvestment)	19.421	0.00		
HDFC Focused 30 Fund - Direct Plan - IDCW Option (Payout and Reinvestment)	22.473	2.00	10.00	
HDFC Capital Builder Value Fund - Regular Plan - IDCW Option (Payout and Reinvestment)	29.765		10.00	
HDFC Capital Builder Value Fund - Direct Plan - IDCW Option (Payout and Reinvestment)	33.871	3.00		

# The distribution will be subject to the availability of distributable surplus on the Record Date and

## Pursuant to the Distribution, the NAV of the IDCW Option(s) of the above Scheme(s) would fall to the extent of such distribution and statutory levy, if any.

Amount will be paid, net of applicable tax deducted at source (TDS), to those Unit holders / Beneficial Owners whose names appear in the Register of Unit holders maintained by the Fund / Statements of Beneficial Ownership maintained by the Depositories, as applicable, under the IDCW Option(s) of the aforesaid Scheme(s) on the Record Date (including investors whose valid purchase / switch-inrequests are received by the Fund and the funds are available for utilization before cut-off timings in respect of the aforesaid Scheme(s), on the Record date).

With regard to Unit holders who have opted for Reinvestment facility under the IDCW Option(s), the amount due (net of applicable TDS) will be reinvested, by allotting Units at the ex-Distribution NAV per Unit (adjusted for applicable stamp duty).

Unit holders are advised to opt for payout through electronic mode(s) at the earliest due to the inherent benefits of such mode(s) such as convenience of the credit of the distribution proceeds into their bank account directly as also avoiding loss of payment instruments in transit or fraudulent encashment. Please arrange to send us a copy of a cancelled cheque of your bank account to have the electronic payout mode enabled.

Intimation of any change of address / bank details should be immediately forwarded to the Investor Service Centres of the Fund (for units held in non-demat form) / Depository Participant (for units held

In view of individual nature of tax consequences, each investor should seek appropriate advice.

For HDFC Asset Management Company Limited (Investment Manager to HDFC Mutual Fund)

Place: Mumbai Date: February 11, 2022 Authorized Signatory

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS, READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

# CAREER POINT LIMITED

Registered Office: Village Tangori, Banur, Mohali, Punjab-140601-India Corporate Office: CP Tower-1, Road No.1, IPIA, Kota-324005 (Raj.)

CIN: L80100PB2000PLC054497 | Ph: 080-47250011 | website: www.cpil.in | E-mail: investors@cpil.in

EXTRACT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 31 DECEMBER, 2021 (₹ in Lakhs Except Per Share Data)

		A TITLE MARKET MET MET AND	for a not delight to married.
PARTICULARS	Quarter Ended (31/12/2021)	Corresponding Quarter Ended (31/12/2020)	Nine Month Ended (31/12/2021)
	(Unaudited)	(Unaudited)	(Unaudited)
Total Income from Operations (net)	1,496.80	1,602.71	4,088.88
Net Profit from Ordinary Activities after tax before Minority Interest	701.13	881.76	1911.08
Net Profit for the period after tax and Minority Interest	701.14	557.10	1,911.08
Paid-up Equity Share Capital (Face value of ₹ 10/- each)	1,819.29	1,819.29	1,819.29
Reserves excluding Revaluation Reserve (NIL) as per balance sheet of previous year		i.e.	50
Earnings Per Share (EPS)			
a) Basic EPS	3.85	4.85	10.50
b) Diluted EPS	3.84	4.85	10.49
Notes:			

Summarised Unaudited Standalone Financial Results of the Company for the Quarter ended December 31, 2021 is as under:

(₹ in Lakhs Except Per Share Data) Corresponding Nine Month Quarter Ended Quarter Ended Ended PARTICULARS (31/12/2021) (31/12/2020) (31/12/2021) (Unaudited) (Unaudited) (Unaudited) Total Income from Operations (net) 1,096.81 544.27 2,315.99 Net Profit for the period after tax and Minority Interest 370.35 520.51 1057.49 1,819.29 Paid-up Equity Share Capital (Face value of ₹ 10/- each) 1,819.29 1,819.29 Reserves excluding Revaluation Reserve (NIL) as per balance sheet of previous year Earnings Per Share (EPS) a) Basic EPS 2.04 2.87 5.81 2.03 2.87 5.80 b) Diluted EPS

The unaudited consolidated financial results of the Company have been reviewed by the Audit Committee and have been approved by the Board of Directors at their respective meetings held on 10th February, 2022. Limited review of these results has been carried out by the auditors.

. The above is an extract of the detailed format of Standalone and Consolidated Financial Results for the Quarter ended December 31. 2021 filled with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full format of the Quarterly Financial Results are available on the Company's website i.e. www.cpil.in and Stock Exchange websites i.e. www.bseindia.com and www.nseindia.com. BY ORDER OF THE BOARD OF DIRECTORS

FOR CAREER POINT LIMITED PRAMOD MAHESHWARI

Place: Kota (Rajasthan) Chairman, Managing Director and CEO Date: February 10\*, 2022 DIN-00185711



# ANUPAM RASAYAN INDIA LTD.

CIN - L24231GJ2003PLC042988

Regd. office: Anupam Rasayan India Ltd. 8110, GIDC Industrial Estate, Sachin, Surat - 394230, Gujarat, Tel: +91 261 2398991-95, Website: www.anupamrasayan.com, Email: investors@anupamrasayan.com

1. Extract from the Unaudited Consolidated Financial Results of Anupam Rasayan India Ltd. for the quarter ended December 31, 2021

Amount (INR) in million except earning per share

Particulars	C	luarter ende	ed	Half Year Ended		Year Ended	
			31-Dec-20 Unaudited			31-Mar-21 Audited	
Total Revenue	2,711.22	2,551.62	1,895.62	7,642.52	5,631.61	8,373.21	
Net Profit / (Loss) (before Tax & Exceptional items)	593.16	502.00	312.71	1,534.81	668.29	1,000.03	
Net Profit / (Loss) before Tax (after Exceptional items)	593.16	502.00	312.71	1,534.81	668.29	1,000.03	
Net Profit / (Loss) (after Tax & Exceptional items)	379.03	360.53	216.46	1,060.76	481.52	702.96	
Total Comprehensive Income	379.77	358.40	213.92	1,049.92	471.28	695.49	
Share Capital	999.22	999.22	862.07	999.22	862.07	999.22	
Reserves (excluding Revaluation Reserves) as shown in the Audited Balance Sheet	5.0	84				14,734.80	
Earnings Per Share Basic & Diluted (Face Value of Rs. 5/- each)							
(-) Basic EPS (Rs.)	3.79	3.61	2.65	10.62	6.04	8.56	
(-) Diluted EPS (Rs.)	3.78	3.59	2.65	10.57	6.04	8.56	

2. Extract from the Unaudited Standalone Financial Results of Anupam Rasayan India Ltd. for the quarter ended December 31, 2021

Particulars	0	Quarter ended			Half Year Ended	
	31-Dec-21 Unaudited	2000 DOMESTIC (\$1000 DOMESTIC)	31-Dec-20 Unaudited		E. P. De Constant Design Services	31-Mar-21 Audited
Total Revenue	2,711.22	2,551.62	1,895.92	7,642.52	5,631.59	8,373.19
Net Profit / (Loss) (before Tax & Exceptional items)	595.27	496.32	310.35	1,528.65	662.82	994.24
Net Profit / (Loss) before Tax (after Exceptional items)	595.27	496.32	310.35	1,528.65	662.82	994.24
Net Profit / (Loss) (after Tax & Exceptional items)	378.83	358.27	214.29	1,056.88	477.25	699.21
Total Comprehensive Income	379.57	356.14	211.75	1,046.04	467.01	691.75
Share Capital	999.22	999.22	862.07	999.22	862.07	999.22
Reserves (excluding Revaluation Reserves) as shown in the Audited Balance Sheet	25	9 <del>2</del>	15	5	s:-	14,726.86
Earnings Per Share Basic & Diluted (Face Value of Rs. 5/- each)						
(-) Basic EPS (Rs.)	3.79	3.59	2.62	10.58	5.98	8.51
(-) Diluted EPS (Rs.)	3.78	3.57	2.62	10.54	5.98	8.51

- [1] The above financial results for the quarter and nine months ended December 31,2021 have been prepared by the Company in accordance with Regulation 33 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations. 2015 (as amended) and were reviewed by the Audit Committee of the Board of Directors of the Company and thereafter were approved and taken on record by the Board of Directors in their meeting held on 11th February, 2022. An interim review of the above results has been carried out by the statutory auditors of the Company. The full format of the Quarterly Financial results are available on the stock exchanges website: www.bseindia.com and www.nseindia.com and also on the company's website: www.anupamrasayan.com.
- [2] Based on the management approach as defined in Ind AS 108 Operating Segments, the Chief Operating Decision Maker (CODM) evaluates the company's performance and allocates resources based on an analysis of various performance indicators of business segment/s in which the company operates. The Company is primarily engaged in the business of custom synthesis and manufacturing of specialty chemicals which the management and CODM recognise as the sole business segment. Hence, disclosure of segment-wise information is not required and accordingly not provided.
- [3] The Company has taken into account the potential impacts of Covid-19 in the preparation of financial results . Based on the information currently available there is no material impact on the carrying amount of assets and hence no provision for any impairment is required. As the situation unfolds in future, the eventful impact may be different from the estimates made as on the date of approval of these Financial Results.
- [4] The figures of the previous period have been re-grouped/rearranged and/or recasted wherever considered

For ANUPAM RASAYAN INDIA LIMITED Mr. Anand Desai Managing Director DIN:00038442

Adfactors 583

financialexp.epap.in

Date: February 11, 2022

Place: Surat

Company Secretary and Compliance Officer





Place: Surat

Date: February 11, 2022









## વરાછા બેંકની ખાસ સાધારણ સભામાં સભાસદોએ મલ્ટી સ્ટેટ કો-ઓ. બેંકના દરજજાને મંજુરી આપી

સુરત, તા. ૧૧ ઉપસ્થિત રહયા હતા. ગુજરાતની સહકારી બેંકોમાં અગ્રગલ્ય એવી વરાછાળેંકના તમામ ખાતેદારો અકસ્માત ધી વરાછા કો-ઓ.બેંક લિ., સુરતને આરબીઆઇ વિમા કવચથી સુરક્ષિત છે. અકસ્માતે ખાતેદારનું તરફથી મલ્ટી સ્ટેટ કાર્યશ્રેગ માટેની મંજુરી મળતા અવસાન થાય તો બચત ખાતેદારને રૂા. ૧ લાખ, તરફથા મહત સ્ટર કોયલાશ માટના મેજુના મળતા અવસાન થાય તો બચત ખાતદારના ફા. યુ લાખ, તે અંગે મહતી કરેટ કોન્સો બેંક એક રાજુબ થેટા કરેટ ખાતેદારને રૂ. ર લાખ, લોન ખાતેદારને કાયદો બનાવી સભાસદોની મેજુરી અર્થ ખાસ રૂા. ર લાખ તેમજ એફડી હોલ્ડરને રૂા. પ૦ સાધારણ સભાનું આયોજન બોમ્બે માર્કેટ હજારની વિમા રાશી મળવામાગ થાય છે. બેંકના ઓડીટોરીયમ હોલ, સુરત ખાતે કરવામાં આવ્યુ ખાતેદાર કોતિભાઇ ધનજીભાઇ હિરપરા બાઇક હતું. સભામાં વરાછા બેંકના મૃતક ખાતેદાર રવ. લઇને જતા હતા, બાઇક સ્લીપ થઇ જતા તેઓને કોતિભાઇ ધનજીભાઇ હિરપરા તેમજ સ્વ. માથાના ભાગે ગંભીર ઇજા થવાથી મૃત્યુ પામ્યા

હતું. સત્યાના પરાઇખ લગ્યા તૃતર ખાતરાદ ત્યા. લાઇખ રતા હતા, ખાઇઝ લ્લાય વઇ જતા તળા કોતિલાઈ ધન્યજી ભાઈ કિરયા તે તે જ સ્ત્ર ... પાચાના ભાગે આંગી દે જેલા થયાં મૃત્યુ પાચ્યા પ્રચિભાઇ ભગવાનભાઇ કાનાશીના વાસ્સદારને હતા. જેમનું કોચિંગ ખાતું એન્ કંટરે ખાતુ હોવાથી ખાત્રા ખાત્રા પાત્રા કાનાશીના વાસ્સદારને હતા. જેમનું કોચિંગ ખાતું અને કંટરે ખાતુ હોવાથી સ્ત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. ખાત્ર સાધારો માત્ર માત્ર

બારડોલીના મોવાછી

ગામે કોલ્ડ સ્ટોરેજમાં આગ લાગી ધબકાર પ્રતિનિધિ, બારડોલી, તા. ૧૧ બારડોલી તાલુકાના મોવાછી ગામની સિમમાં આવેલ અભિનંદન એગ્રો કોલ્ડ સ્ટોરેજમાં વહેલી સવારે આગ લાગી હતી. મોવાછી ગામ ની સીમ માં વહેલી સવારે અભિનંદન એગ્રો કોલ્ડ સ્ટોરેજ સંવાર ગોલવાઈ ગક્કા કારડ સ્ટાર ક માં મુકેલા અનાજ અને ગોળ ના જથ્થા માં આગ લાગતા ધુમાડા ના ગોટા દેખાતા કોલ્ડ સ્ટોરેજ ના માલિક ને ત્રણ કરતા માલિકે સ્થળ પર આવી

બારડોલી નગરપાલિકા ની ફાયર ટિમ ને જાણ કરવામાં આવતા સવારે બારડોલી ની ફાયર ની ટીમે આગ

પર કાબ મેળવવા ની કામગીરી શરૂ કરવામાં આવી સાથે સાથ કામરેજ કાયર પણ ઘટના સ્થળે આવી આગ

હોલવાની કામગીરી માં જોડાય હતી જોકે કોલ્ડ સ્ટોરેજ માં રાત્રી દરમ્યાન કોઇ કામગીરી કરતા કામદારો હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી ૪ કલાક થી વધુ સમય બાદ આગ પર કાબુ મેળવવા માં ફ્રાયર ની ટિમ ને સફળતા મળી હતી સમગ્ર ઘટનામાં કોલ્ડ સ્ટોરેજ માં મુકવામાં આવેલ મોટી માત્રામાં અનાજ તેમજ ગોળ ના જથ્થો બળી ને રાખ થઇ ગયો જો ચેમ્બર દ્વારા આજે જીએસટી એન્ડ કસ્ટમ વિશે પોસ્ટ બજેટ એનાલિસિસ વેબિનાર યોજાશે

સુરત, તા. ૧૧ શ્રીધરનના પાર્ટનર જિગર શાહ અને ધી સધને ગુજરાત ચેમ્બર ઓક જોઇન્ટ પાર્ટનર મનિષ્ય જૈન દ્વારા કોમસે એન્ડ ઇન્સ્ફ્રી દ્વારા શનિવાર, ભજેટ પાઈ છએસાટી અને ક્રસ્ટમ વિશે તા. ૧૩ કેંબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ એનોલિસિસ રજૂ કરવામાં આવશે. સાંજે ૪:૩૦ કલાકે 'પોસ્ટ બજેટ આ વેબિનારમાં જોડાવવા માટે વકતા તરીકે લક્ષ્મીકમારન એન્ડ રહેશે.

સાજ ઉગ્ગાલિસિક ઓન જીએસટી એન્ડ ચુગલ લીન્ક https://bit.ly/ કસ્ટમ' વિષય ઉપર વેબિનારનું 34GxhLE ઉપર કરજિયાતપણે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું

## સર્ટીફીકેટ વિતરણ સમારોહ યોજાયો કે. પી. કોમર્સ કોલેજ કેમ્પસમાં આવેલ કોમર્સ ભવનમાં છેલ્લા ૨૨ વર્ષથી આ કોર્સ ચાલે છે



સાર્વજનિક એજયુકેશન સમારોહ યોજાયો હતો. સોસાયટીના નેજા હેઠળ કે. પી. કોમર્સ આ કાર્યક્રમની સાસાનદાયા ૧૪ લ્ટગ્યાં કાય કોલેજ કેમ્પસમાં આવેલ કોમર્સ ભાવનમાં સહકારી બેંકનાં કર્મચારીઓને ઉપયોગી થાય તેવો. પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા ઇન બેંકિંગ છે, જેના શૈક્ષણિક વર્ષ ૨૦૨૦–૨૧નાં સફળ વિદ્યાર્થીઓને સ્થાનિક વહીવટી નિમેષભાઇ કાપડીયાનાં અતિથિ હતી.

**સુરત, તા. ૧૧** વિશેષપદે સર્ટીફ્રીકેટ અર્પણ કરવાનો

આ કાર્યક્રમની શરૂઆતમાં આ ઝાયું કરવા તે તે હતા તે આસી. નિયામક યુનુસ પટેલે મહેમાનોનો પરિચય તેમજ ચાલુ વર્ષ નવા શરૂ થનારા અભ્યાસક્રમો જેવા કે JAIIB, સાઇબર સિક્યોરિટી કોર્સ' આ કોર્સ છેલ્લા ૨૨ વર્ષથી ચાલે. વયસ્કોની કેર ટેકર નેશનલ સ્ટોક એક્સચેજ વગેરેની માહિતી આપી હતી. તમામ સફળ વિદ્યાર્થીઓને બંને સમિતિના અધ્યક્ષ મયંકભાઇ મહેમાનોના હસ્તે માર્કશીટ અને ત્રિવેદીનાં પ્રમુખપદે તેમજ સુટેશ સટીફ્રીકેટ આપવામાં આવ્યા હતા. બેંકનાં લીગલ ડીપાર્ટમેન્ટનાં હેડ આત્માર વિધિ સુશાંત ફુટેકરે કરી



### અનુપમ રસાચણ ઈન્ડીયા લીમીટેડ

સીઆઈએલ – 124231G12003P1004988 ૨જી. ઓફીસ: અલુપમ રસાયણ ઇન્ડીયા હિ. ૮૧૧૦, સચિલ જી.આઇ.ડી.સી. ઇન્ટેટ, સચિલ, સુરત-૩૯૪૩૦, ગુજરાત, ઇન્ડીયા. ફોલ લો.: +91 7817388991.95, ઇન્યાઇટ: www.ampamrasyan.com, ઈ મેઇલ: investors@anupamrasayan.com

#### પોસ્ટલ બેલેટ નોટિસ અને ઈ-વોટિંગ માહિતી

. રનામું નોંધણી / અપડેટ કરવાની રીત : લેટ નોરીસ અને ઈ-વોરિંગ માટે :

ઉપલબ્ધ છે. — તેમના માં મોઘલી / અપહેદ કરવાની રીત:

"મેહિલ સરનામું નોંઘાલી / અપહેદ કરવાની રીત:

પોક્ટલ વેરીલ નોંઘાલી અને વર્ન-વીડિંગ માટે સભ્યોલે તેમના છું--કોલર હોટ્સની લોંઘાડી/અપહેદ કરવાના મને લીંચીની સુખાવાની તાંધા હોય અને અનુસરદા વિનાર્દા કે કોમાં રેસ લોંઘાડી/અપહેદ કરવા માટે લીંચીની સુખાવાની તાંધા હોય અને અનુસરદા વિનાર્દા કર્મમાં કે પહેલા કર્માં કરે છે. કે દર્શ કરવાને કરવાના માત્રે કર્યા કર્માં કરે હોય, કરવાના માત્રે હોય, કરવાના અને તાંધા એક એક તો લીંચા કરવા અને તેમના લીં--કોમાં એક એક તેમના લીંચા કરવા અને તેમના લીં--કોમાં એક એક તેમના લીંચા કરવા માટે હોય, કે હોય, કાર્ય કરવામાં આવેલા કરવા માટે હોય, કે હોય, કાર્ય કરવામાં આવેલા કરવા અને તેમના લીં--કોમાં એક એક તેમના લીંચા કર્યા અને હોય, કે હોય, કાર્ય કરવામાં આવેલા કરવા કરવા કરવામાં આવેલા કરવા કરવા કરવામાં આવેલા કરવામાં હોય, કરવામાં કર્યા કરવામાં કરવામાં કર્યા કરવામાં કરવામાં અને હાતા કરવામાં કર્યા કરવામાં કરવા

સાવ્યાના સારિતા માટેનો દ્વારા ફ્રી નંબર : ૧૮૦૦ –૧૫૧૦ સંપર્ક કરી શકે છે અથવા <u>evoting@nsdl.co.in</u> ઉપર ઈ–મેઇલ **અનુપમ સ્ટ** 

ારીખઃ ૧૧/૦૨/૨૦૨૨



# પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન બેંકિંગ કોર્સનો પ્રવૃતિ અને પ્રકૃતિમાં પરિવર્તન આવે તો જીવન સુગંધી બને : આચાર્ય રત્નસુંદરજી

૨૨ વર્ષ પછી સુરત પધારેલા આચાર્ય રત્નસુંદરજીની પાલ સ્થિત શંખેશ્વર હાઈટ્સની બાજમાં એસ.એમસી ગ્રાઉન્ડમાં ચાલતી પ્રવચન માળાનો આજે આખરી દિવસ

સુરત,તા.1 ૧ પાલ સ્થિત શંખે મર દાઈટ્સની બાજુમાં એસ.એમસી ગ્રાઉ-ડના બંધાયેલ વિગ્રાળ સામિયાશામાં પહલુપાક જૈનાચાર્ય પુ. સન્સુરિક્ઝ મ. અને પ્-માસપ્રવર પહલુનિજિયલ્લ અ. આદિ શ્રમાહ-શ્રમાલી વૃંકની પાલન નિશ્રામાં ચાલતી પ્રવચનમાળાનો અપૂર્વ માહોલ જામ્યો છે, જેમાં મોટી સંખ્યામાં બાલુકો અનુનાલાલીનું આચનમ કરી રહ્યાં છે. સ્ટ વર્ષ પછી સુરતની પત્યાં પ્લાન કરતા આ મહાસામાની પત્યાં પ્લાન કરતા આ મહાસામાની

ખત્તના ભ્રાપગ્યમ વધાવતા પ્રવંતન લાખા જો બીખરા દિવસ સુરત,તા.૧૧ પોતાના તમામ મોજશોખનું બલિદાન તર હાઈટ્સની આપવા તૈયાર થઈ જાય તે પુત્રવધું છે, પુત્રય પરવારો ત્યારે હતું નહતું વધું સી ગ્રાઈન્તમાં હેલાય જીવનનું બેહું પરિવર્તન નહીં કે. સામિયાદામાં ગ્રાહે. બનીંગ પરિવર્તન જોઈં. હેપ્યુ પરવારો ત્યારે હતું ને પહુંપાએ રાત્મસિજાદ મ., વિશાસની ઈમારત મજબૂત બનવી દિજી મ. અને જોઈએ, પરિવર્તન લાવતા તમારે કોઈંડ નફિજયદ મ., ચુલત્ર પુત્ર છે. જીવન મ ન અને કદય વૃદની પાવન પરિવર્તન કરવા માટે પિંજળ, તમાળાનો અપુર્વ પુત્રબળ, પ્રાલળ, પીઠળ અને આપ્રક્રમ તામારી પ્રશાન કોઈ કોઈંડ મોગી સંખ્યામાં પ્રભુમળ જોઈશે, પિંડ એટલે શરીરનું તમો તમારા જીવનમાં કોઈકના પછી સુરતની આ અને સમ બધુ બરાબર છે. આવા ભૂલતા નહીં. કોઈના પીઠબળ વિના આ મહાનાની સમયે પર્મ શય નાં સુધી કરી લીલો જુવતવાસા સાર્ધ માં પ્રવાર ને પ્રવાર કહ્યું જેઈએ, રાર્ચરનું ક્રંપાય હવાનિયા કાર્યક નો પ્રવાર નું સ્વલ્ય કહ્યું જોઈએ, પરિવાર, તું ચલલ કરવું જોઈએ, રાર્ચરનું કૃપાય ખત્ત્વનું કૃપાય જીવનવિકાસ શરૂન નથી. પરિવાર, તું ચલલ કરવું જોઈએ, રાર્ચરનું કૃપાય ખત્ત્વનું કૃપાય ખત્ન ક્ષાય કે દેશમાં જુલાં પદ્માં પ્રવાર ,

તેમવેલાનો પોપાને હતાં આ મહાલામાં તેમાવે વર્ષ થયા તતા લું લું કરો લાયાં જેવનાવાં કરતે છે. માં વધા પ્રાથમિક કે કહ્યા માર્ચા કરે હોંચ ત્યાં કરો હોંચ ત્યાં કરો હોંઘ ત્યાં કટ્ટોલ છે. એ જેવનના એક લાહાવો છે. છેંછે. એને ધમ કરો શેજ ઉંમરે વર્ષ છે હોય ત્યાં કટ્ટોલ કરો, પ્રણુ આપલા કું આ ત્યાં મેટ્ટેલ્ટિક્ટ મહારાજે અને જેવન રોજ થીટ લું છે. કર્યું હતું કે, પ્રકૃતિ અને પ્રકૃતિમાં પુષ્મનો સદ્ભાગ કરો, પૂષ્મનું પાછળ નહીં હોય તો જેવન સ્ટિટર્બ પરિવર્તન આવે તો જેવન સુર્પોલ બેને પીકળ હોય ત્યાં દેશ ત્વે કુટ સ્થાનું છોડી પોછળ વધી હોય તો જેવન સ્ટિટર્બ જે વહુ પોતાની સાસુને સાથવવા માટે એક.ડી.ઓઇ! કરો. ભેગુ કરવાનું છોડી પીઠળળ છે.



### ANUPAM RASAYAN INDIA LTD.

CIN - L24231GJ2003PLC042988
Rasayan India Ltd. 8110, GIDC Indiustrial Estate, Sachin, Surat - 394230, Gujarat : 491 261 2398991-95, **Website**: www.anupamrasayan.com,
Email: invectoro@onupamrasayan.com

### 1. Extract from the Unaudited Consolidated Financial Results of Anupam Resevan India Ltd.

for the quarter ended December 31, 2021  Amount (INR) in million except earning per share						
Particulars	0	Quarter ended			Half Year Ended	
			31-Dec-20 Unaudited		31-Dec-20 Unaudited	31-Mar-21 Audited
Total Revenue	2,711.22	2,551.62	1,895.62	7,642.52	5,631.61	8,373.21
Net Profit / (Loss) (before Tax & Exceptional items)	593.16	502.00	312.71	1,534.81	668.29	1,000.03
Net Profit / (Loss) before Tax (after Exceptional items)	593.16	502.00	312.71	1,534.81	668.29	1,000.03
Net Profit / (Loss) (after Tax & Exceptional items)	379.03	360.53	216.46	1,060.76	481.52	702.96
Total Comprohonsivo Incomo	379.77	358.40	213.92	1,049.92	471.28	695.49
Share Capital	999.22	999.22	862.07	999.22	862.07	999.22
Reserves (excluding Revaluation Reserves) as shown in the Audited Balance Sheet						14,734.80
Earnings Per Share Basic & Diluted (Face Value of Rs. 5/- each)						
(-) Basic EPS (Rs.)	3.79	3.61	2.65	10.62	6.04	8.56
(-) Diluted EPS (Rs.)	3.78	3.59	2.65	10.57	6.04	8.56

Extract from the Unaudited Standalone Financial Results of Anupam Rasayan India Ltd for the quarter ended December 31, 2021

			Ended	
31-Dec-20 Unaudited				
1,895.92	7,642.52	5,631.59	8,373.19	
310.35	1,528.65	662.82	994.24	
310.35	1,528.65	662.82	994.24	

Half Year Ended Year

Particulars						Ended
	31-Dec-21 Unaudited			31-Dec-21 Unaudited	31-Dec-20 Unaudited	31-Mar-21 Audited
Total Revenue	2,711.22	2,551.62	1,895.92	7,642.52	5,631.59	8,373.19
Net Profit / (Loss) (before Tax & Exceptional items)	595.27	496.32	310.35	1,528.65	662.82	994.24
Net Profit / (Loss) before Tax (after Exceptional items)	595.27	496.32	310.35	1,528.65	662.82	994.24
Net Profit / (Loss) (after Tax & Exceptional items)	378.83	358.27	214.29	1,056.88	477.25	699.21
Total Comprehensive Income	379.57	356.14	211.75	1,046.04	467.01	691.75
Share Capital	999.22	999.22	862.07	999.22	862.07	999.22
Reserves (excluding Revaluation Reserves) as shown in the Audited Balance Sheet						14,726.86
Earnings Per Share Basic & Diluted (Face Value of Rs. 5/- each)						
(-) Basic EPS (Rs.)	3.79	3.59	2.62	10.58	5.98	8.51
(-) Diluted EPS (Rs.)	3.78	3.57	2.62	10.54	5.98	8.51

- The above francial results for the quarter and nine months ended December 31,2021 have been prepared by the Company in accordance with Regulation 33 of SERI Usins (Displayations 61 Disclosures Requirements) Regulations 2015 (as a monded) and ware reviewed by the Audit Committee of the Board of Directors of the Company in a contract of Directors in their mention plant of 11 The Audit Committee of the Board of Directors in their mention plant of 11 The Audit Committee of the Board of Directors in their mention plant of 11 The Audit Committee of the Board of Directors in their mention plant of 11 The Company. The full formed of the Custarty Financial results are available on the stock exchanges website: www.besites and and www.nseindia.com and also on the company's website: www.anuparmassyan.com.

  Based on the management approach as defined in Ind AS 105 Operating Segments, the Chief Operating Discision Maker (CODM) evolustes the company's performance and allocates resources based on an analysis of virous performance indicators of business segments. When which the company propress The Company is primarily engaged in the business of custom synthesis and manufacturing of specialty chemicals which the management and CODM recognise as the sole business segment. Hence, disclosure of segment-vise information is not required and accordingly not provided.
- The Company has them into account the potential impacts of Covid-19 in the preparation of financial results. Based on the information currently available there is no material impact on the carrying amount of assets and hence no provision for any impairment is reguried. As the situation unifodis in future, the ventful impact may be different from the estimates made as on the date of approval of these Financial Results.

Place: Surat Date: February 11, 2022

Mr. Anand Desai Managing Director DIN.00038442

### કે આગ લાગવા પાછળ નું કારણ હજી પણ અકબંધ છે. ઇ-પેપર માટ્ટે ક્લિક કરો dhabkar.in

બે મૃતક ખાતેદારોના વારસદારને રૂા. પ-પ લાખની વિમા રકમનો ચેક અર્પણ કરાયો

## જાહેર નિવિદા નં.૧૬ વર્ષ ૨૦૨૧-૨૨

જાતાર ાળાવદા છે. ૧૬ વાવ વર્ષ વર્ષમાં વર્ષ અપ્યાસ્ત્ર ગુજરાત મેરીશાંમ oોર્ડ અપ્યાસ્ત્રી, ગુજરાત મેરીશાંમ બાંદે વતી કાર્યપાલક ઈજનેર (બાં), મગકલા બંદર વિકાસ યોજના, ગુજરાત મેરીશાંમ બાંદ સામર વખત, મકાઈપુલ પાવે નામપુરા, મૃત-૧૦-૪૫૦૦૦ (તાર્ચ મેરી મુજના કાર્ય પાટે રુપ્તો મોપાવવામાં આવે છે. અનુ, કાર્ય નામ તાર્થ ફેલી ૧, એલકાલ ૨૭૧ રૂપ.

	વિગત	ર. બાનાની રકમ ર્શે. ૩. ટેન્ડર ફી રૂા. ૪. શ્રેલી ૫. સમય મર્યાદા
q	ક્લિનિંગ (ડ્રેનેજ એંડ હાઇસ ક્રિપિંગ) ઓફ પોર્ટ કોલોની મગદલ્લા (બીજો પ્રયત્ન)	1. રૂ. 3.4 ૧,૮૯૨ ૦૦)- ૨. રૂ. 36.5 ૮૦૦ (૧૦)- ૩. રૂ. 00.૮ ૦૦)- (જીએસટી મહિત) ૪. એનજીઓ સકાઈ પંગીમાં કે જેની પાસે સુરત જિલ્લા લાલુકામાં જીજીએટ પંચાન હોય અથવા અનુભવી એજનો ઉપર દર્શાવેલ દરેક બીડારને સાંકાભાં આંદલે પ વર્ષન વ્યક્તની અથવા પાસે વસ્તાકારી કચેવીમાં સકાઈના કામન ખતુભવ હોયો જોઈએ.
a,	એન્યુઅલ મેંટેનંસ કોંટ્રકાટ ઓફ પોર્ટ મગદલ્લા (બીજો પ્રયત્ન)	1. ગ્રા./୨૭,૭૫૧.૦૦)- ડ. ગ્રા./૧૭૩.૦૦(૧) ડ. ગ્રે.૧૭૦૮.૦૦(- (જીએટ્ટી સહિત) ૪. એનાજ્યોવકાઈ પંડળીમાં કે જેની પાસે સુરત જિલ્લા તાલુકામાં રજીસ્ટર થયેલ હોય અથવા અનુભવી એજન્સી ઉપર દર્શાવેલ દરેક બીડરને ઓઇમાં ઓઇડ પ વર્ષન સરકારી અથવા અર્ધ સરકારી કરીયો સંલઈના કામન ખનુભવ હોવો જોઈએ. પ. ૧૯(માટ) માત્ર લીમાસા સહિત!

કોરા ભાવપત્રક આપવાની	તારીખ ૧૧/૦૨/૨૦૨૨થી તારીખ ૧૯/૦૨/૨૦૨
તારીખ	૧૮.૦૦ કલાક સુધી
ભરેલ ભાવપત્રકો માત્ર	તારીખ ૨૮/૦૨/૨૦૨૨ના ૧૮.૦૦ કલાક સુધી
રજીસ્ટર એ.ડી. પોસ્ટ/સ્પીડ	
પોસ્ટ હારા શ્રી કાર્યપાલક	
ઈજનેર (બાં), મગદલ્લા	
બંદર વિકાસ યોજના,	
સાગર ભવન, મક્કાઈપુલ	
પાસે નાનપુરા, સુરત-	
૩૯૬૦૦૧ના સરનામે રજ	

### પશ્ચિમ રેલવે

િડિવેઝનલ રેલવે મેનેજરની ઓફિસ કોમર્શિયલ વિભાગ એડવર્ટાઇડિંગ વિભાગ મુંબઇ સેન્ટ્રલ-૪૦૦૦૦૮ નીચે દર્શાવેલ કામો માટે ઇન્ટેન્ડર આવકારે છે.				
અ. નં.	ટેન્ડર નોટિસ નંબર અને તારીખ	કામ અને સ્થળ	જાહેરાત કિંમત (રૂપિયા)	ઈએમડી (રૂપિયા)
1	NIT No. CA11_BulkStn_ST_PF_2022 dated 09.02.2022. E-File: 202524	સુરત પ્લેટકોર્મ સ્ટેશનના બલ્ક એડવર્ટાઇઝીંગ હકો એક વર્ષની અવધિ માટે	20,99,764/-	42,000/-
2	NIT No. CA11_BulkStn_ST_FOB_2022 dated 09.02.2022. E-File: 202524	સુરત સ્ટેશન (એસટી) એફઓબી,સબવે, વેઇટિંગ હોલ અને બુકિંગ ઓફિસ હોલના એડવર્ટાઇઝીગ હકો એક વર્ષની અવધિ માટે	21,21,134/-	42,500/-
3	NIT No. CA11_Bulk3ti1_OTR_2022 dated 09.02.2022. E-File: 214517	ગ્રાન્ટ રોડ સ્ટેશનના એડવર્ટાઇઝીંગ હકો એક વર્ષની અવધિ માટે	13,32,081/-	26,700/-
4	NIT No. CA11_BulkStn_MEL_2022 dated 09.02.2022. E-File: 214517	મરિન લાઇન્સ સ્ટેશનના એડવર્ટાઇઝીંગ હકો એક વર્ષની અવધિ માટે	10.72.800/-	21.500/-

શ્રેષ્ઠ્રી ક્રમાંક: ૧ થી ૪ ઉપરના બધા જ ટેન્ડર્સ. જમાં કરવાની તારીખ અને સમયઃ ૦૯/૦૩/૨૦૨૨ ના ૧૫,૦૦ કલાક સુધી, ખોલવાની તારીખ: સમય : ૦૯/૦૩/૨૦૨૨ ના ૧૫,૭૦ કલાક સુધી, ટેન્ડરની વિગતવાર શરતો માટે www.irps.gov.in ની મુલાકાત લેવા વિનંતી,

Like us on : F facebook.com/WesternRly Follows us on 🛩 twitter.com/WesternRly